

Shree Kishandas Kikani Arts and Commerce College,
Dhandhuka

Assignment (NEP)
COMMERCE
ACADEMIC YEAR 2026-27

બીકોમ સેમેસ્ટર ૩

Cost Accounting 01 DSC-C-ACC-231

૧. પડતર હિસાબી પદ્ધતિનો અર્થ સમજાવી, પડતરના હિસાબો ના ફાયદા અને ગેરફાયદાઓની ચર્ચા કરો
૨. મજૂરી એટલે શું ? સમય વેતન, કાર્ય વેતન, ટેલરની ભિન્ન વેતન, હેલ્સીની તથા રોવેન વેતન પ્રથા સમજાવો.
૩. ટ્રેક નોંધ લખો.
(૧) સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ અને અર્ધચલિત ખર્ચ
(૨) પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ.
૪. ટેન્ડર (અંદાજિત પડતર) એટલે શું? ટેન્ડર કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે તે કાલ્પનિક આંકડા સાથે જણાવો.

Corporate Accounting -1 DSC-C-ACC-232

- Q-1 નોંધણી પહેલાં નફાનો ઉપયોગ કે નુકસાન ની વ્યવસ્થા સમજાવો.
- Q-2 ધંધાની ખરીદ કિંમત નક્કી કરવાની જુદી જુદી પદ્ધતિ સમજાવી, ધંધો ખરીદનાર કંપનીના ચોપડે થતી આમનોંધ જણાવો.
- Q-3 શકમંદ લેણા પરના વ્યાજ અંગેની આમનોંધ જણાવો.

Q-4 બેંકના વાર્ષિક હિસાબો નું ફોર્મેટ જણાવો.

Q-5 નીચેના પદો ઉપર ટૂંકનોંધ લખો:

(૧) પસંદગીના લેણદારો

(૨) સંપૂર્ણ સલામત લેણદારો

(૩) બિન સલામત લેણદારો.

કરવેરા ૦૧(DSC-C-TAX 233)

૧. કરવેરાનું આયોજન અને કર-પરિવર્જન વચ્ચે તફાવત સ્પષ્ટ કરો.

૨. A.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ

B.કમિશનર ઓફ ઇન્કમેટેક્સ પર નોંધ લખો.

૩. બધા પ્રકારના કર્મચારીઓ માટે કરમુક્ત ગણાતી સવલતો વર્ણવો.

૪. કાયમી ખાતા નંબર (પાનકાર્ડ)પર ટૂંક નોંધ લખો.

Common Employability skill (SEC-236)

૧. ભાષા કૌશલ્ય પર નોંધ લખો.

૨. ટીમ વર્ક કૌશલ્ય પર નોંધ લખો.

વૈદિક સંચાલન (MDC-VDM-234)

૧.વૈદિક સંબંધ સંચાલનનું મહત્વ વર્ણવો.

૨.વૈદિક કોસ્મિક સંચાલન નો અર્થ આપી. તેનું મહત્વ સમજાવો.

૩.વેદ અને નાણાકીય સંચાલન પર નોંધ લખો.